


અહુદ્

# જીવન પત્ર્ય



❖ વાર્ષ : 27 ❖ અંક : 4 ❖ S.No. : 426

❖ તા. 16-12-2020 ❖ ડિસેમ્બર

ધૂટક નકલ : રૂ. 6/-

પૂ.પં. શ્રી હૃદયરત્ન વિ.મ.ની પદવી પ્રસંગની જલક



સોજન્ય : માતુશ્રી શોભનાભેન અમરીખભાઈ શાહ, ઉ. ભાવિન, શ્રેષ્ઠુજ

તં દેવદેવ મહિઅં સિરસા વંદે ભાગીરથુ

# શ્રીજાળા પ્રાર્થના

વર્ષ : 27 ♦ અંક : 4

S.No. : 426 ♦ વિ.સ. 2077  
તા. 16-12-2020 ♦ ડિસેમ્બર

: માલિક :

અર્થ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ  
૧૭, ઈલોરચ પાર્ક, ફેન દિલેરાસરરી ખામે,  
નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૧૩.  
ફોન : 079-2768 1317

૨૪૩, પંચરન બીલીંગ, ૨જે માળ,  
અમ.પી.માર્ગ, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪.  
ફોન : 022-23631564, 23808621  
manasmandirtrust@gmail.com  
www.shreejainalertgroup.org

તંત્રી—મુરક્ક—પ્રકાશક  
કલોશભાઈ વિ. શાહ  
અમદાવાદ

ટાઈપ સેટિંગ  
સમ્યક ડીગ્રાઇન એન્ડ પ્રિન્ટ  
અમદાવાદ

મુરક્ક  
સર્વોદય ઓફસેટ  
અમદાવાદ  
મો. : 98245 15514


આજીવન લવાજમ : રૂ. ૫૦૦/-  
ધૂટક નકલ : રૂ. ૬/-

॥ શ્રી પ્રેમ-બુવનભાનુ-અધ્યોષ-રોક્ષન્-હેમરતનસૂરીશ્રેષ્ઠાં નમઃ ॥

યુવાનોના ટેક્સ કાંઠે યુવાનો પડે યાતાંતું મેળેપીન

દિવ્યકૃપા : યુવાહૃદયસાધાટ સ્વ.પૂજય આચાર્ય શ્રી હેમરતનસૂરીશરજી મહારાજા

લેખક : પ.પૂ.પ. શ્રી હૃદયરળ વિ.મ.



## પ્રાર્થના સંવેદના



હે પરમાત્મા ! જ્યારથી જાણ્યું છે  
કે, જ્યાં સુધી જગતના કોઈપણ એક જીવ  
સાથે પણ જો તમારે વૈરભાવ અંતરમાં  
જીવતો હશે તો તમારું પ્રણેયકાળમાં  
કલ્યાણ થવું સંભવ નથી. તમે સુખી  
નહિ થઈ શકો ! પ્રભુ ! આવું જાણા પછી  
મારું મન બેચેન બની ગાયું છે. મને હવે  
કર લાગવા લાગ્યો છે. મારું માથું ચકરાવે  
ચક્કાયું છે.

હે કૃપાસાગર ! હું તો ઘણા સારા  
લોકો સાથે પણ વૈર બાંધીને બેઠો છું.  
અરે ! દુનિયાની વાત તો જવા દે પરંતુ  
મારા ખુદના ફેભિલિમાં પણ મને કોઈ પ્રેમ  
કરતું નથી કે હું કોઈને ગમતો નથી. મને  
બધા જ જાણે મારા દુશ્મન લાગી રહ્યા છે.

જ્યારે ઘરની બહાર જવાનું થાય છે  
થારે બે પ્રણ દિવસમાં તો પાછું ઘર ચાદ  
આવી જાય છે. લાગે છે મને બધા ચાદ  
કરી રહ્યા છે. જાણે મારા વિના બધા સૂના  
પડ્યા છે એટલે જલદી જલદી કાર્ય પતાવી  
ઘર ભેગો થાઉં છું. પરંતુ જ્યાં ઘરમાં  
દાખલ થાઉં છું ત્યાં મને બધા જ જાણે  
ઘૂરકી ઘૂરકીને જોયા કરે છે.

મારા ઘરમાં જ્યાથી પત્ની ચૂપ થઈ  
જાય છે. બાળકોની રમત પૂરી થઈ જાય  
છે. બા અંદરના રૂમમાં ચાલી જાય છે અને  
હું એકલો હીજરાયા કરું છું. હે પ્રભુ !  
મારા ઉપર તું કંઈક દયા કર અને  
મારામાંથી વૈર કાઢી પ્રેમનું સિંચન કર !  
મારી આંખમાં અમી પ્રગાટાવ ! જેથી હું  
બધાને ગમું, મારી પાસે સહુ બેસે,  
મારાથી કોઈ દૂર ભાગે નહિ. મારા  
બોલવાથી કોઈનું મન ભાંગો નહિ અને  
મારા ચાલવાથી કોઈનું તન ભાંગો નહિ. હે  
દયાળું ! આટલી કરણા કર ! તું જ  
કરણાસાગર છે, બીજા કોની પાસે  
જાઉં ?

માણસ દિવસ ઉગેને મનોરથોના  
મહેલ ચોણે છે અને જ્યારે તે મહેલો ધ્વસ્ત  
થાય છે ત્યારે તે અફસોસ કરે છે. આમ  
ધ્વસ્ત થયેલા અરમાનોના ટગાલાથી ઘર  
ભરાઈ ગાયું છે તેના અફસોસ કરીને  
અફસોસોની ફાઈલોનું કબાટ ચિક્કાર ભર્યું  
છે.

કોલેજમાં નંબર ગ્રૂપમાંના અફસોસ,  
જીવન સંગીનીની પસંદગીમાં ચૂકી ગયાનો  
અફસોસ, બાળકોને સંસ્કારો ન આપી  
શક્યાનો અફસોસ, ધંધામાં ચાન્સ  
ગ્રૂપમાંના અફસોસ, બોસના પ્રસંગમાં  
હાજર ન રહી શક્યાનો અફસોસ, બાને  
જીવ તે જીવ ચાત્રા ન કરાવી શક્યાનો  
અફસોસ, બાપુજીની સાવ સામાન્ય  
ઈચ્છાઓની પણ સતત ઉપેક્ષા કરી પૂરી ન  
કરી શકવાનો અફસોસ.

આવા અનેક અફસોસોની ફાઈલો  
માણસના મનના સેઈફ ટીપોગ્રાફ વોલ્ટમાં  
સંગ્રહેલી પડી છે. આ બધાય અફસોસો  
મૃત્યુ આવતાં જ મરી જશે, દફનાઈ જશે.  
મોટો અફસોસ તો હવે પછી પેદા ચચાનો છે  
કે, માનવ જન્મ આમ જ ખોઈ નાંખવાનો  
અફસોસ !

સારી-સુંદર-બ્યુટીફૂલ લાઈફ મળ્યા  
પછી પણ કરવા ચોગ્ય ન કર્યાનો  
અફસોસ ! ન કરવાનું જિંદગીભર કર્યા  
કરવાનું પાગલપન અફસોસ બની નવા  
ભવમાં પણ દગ્ગાડ્યા કરશે. આ લાઈફની  
ભેટમાં જો પશુઓનિમાં ચાલ્યા જવું પડશે તો  
અફસોસ અફસોસ અફસોસ ! અફસોસનો  
કોઈ પાર નહિ રહે, જરા વિચારો !

ગજ બહારનો મનોરથ નહિ, શક્તિ  
બહારની ઈચ્છાઓ નહિ, પાત્રતા વિનાની  
અપેક્ષાઓ નહિ. નસીબ વિનાનો ખેલ નહિ.  
તો પછી જીવનમાં અફસોસ પણ નહિ !

હેમસૂત્ર

આત્મશક્તિનો ઉપયોગ જે દિશામાં થાય તે દિશાની શક્તિઓ  
વધે છે. ખરાબ માર્ગમાં વપરાતી શક્તિ ખરાબી વધારે.

ડિસેમ્બર - 2020

### યોગ સિદ્ધ માટે પ્રયત્ન કરવો જોઈએ.

યોગપૂર્વસેવાના કર્તવ્યો અંતર્ગત યોગસિદ્ધ કરવા પ્રથમ આપણે 'યોગ' શું છે તે જોઈ રહ્યા છીએ. 'યોગબીજો'ની વાત ચાલી રહી છે. તે કેવી રીતે અંતરમાં વવાય તેની વાત ચાલી રહી છે. બીજું યોગબીજો વૈયાવચ્ચાયે.

પરમાત્માનો ભેખ લઈને - સંસાર ત્યાગી પાંચ મહાવતોનો ભાર વહન કરી અનેક ભવ્યજીવોને ધર્મમાર્ગમાં લાવતા અને સ્થિર કરતા પૂર્ણસાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ કેમ કરવી, કેવી રીતે કરવી, તેમાંય પહેલાં આચાર્યની વૈયાવચ્ચ કહી, પછી સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચમાં લાખો રૂપિયા લખાવનારા ધન્યવાદને પાત્ર છે. વિહાર માર્ગોમાં સુંદર વ્યવસ્થાઓ ઊભી કરનારા ધન્યવાદને પાત્ર છે. વિહારમાં સાધુના ઉતારા માટે પોતાના ઘર ખાલી કરી આપનારા, સ્કુલોના દરવાજા ખોલી આપનારા તથા સંસ્થાના મકાનો રાજી થઈ સાધુને વાપરવા આપનારા જેનેર ભાઈઓ તો ખાસ ધન્યવાદને પાત્ર છે.

એવા કેટલાય જેનેતર ડૉક્ટરો મળ્યા છે જેઓનો જેણ સાધુ પ્રત્યે ઉંચો આદર જોવા મળ્યો છે. મેડીકલ ટ્રીપ્લેનેન્ટનો એક પૈસો પણ ચાર્જ ન કરે અને ગમે ત્યારે બોલાવો તો હાજર ! ભલે એમ.રી.ડૉક્ટર હોય પોતાની વિગ્રિટ પણ પડતી મૂકી જેણ સાધુ માટે સેવામાં તૈયાર હોય. આવા વૈધો અને ડૉક્ટરોને પણ ધન્યવાદ છે. આ બધા જીવો યોગબીજના અધિકારી છે તેમ કહેવામાં ખોટું નથી.

રાજકીય ક્ષેત્રે પણ એવા અમલદારો, નેતાઓ છે. જેઓ સાધુ પ્રત્યે અત્યંત આદર ધરાવે છે. થોડાક વખત પહેલાં ભારતના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના બંગલામાં સુરતમાં દીક્ષિત થનાર ૪૫ મુમુક્ષુઓને આમંત્રણ આપી સંધ્યાભોજન કરાવી દીક્ષા જીવનની અનુમોદના કરી. આ પણ યોગબીજી કહેવું પડેશે.

શહેરોમાં કફ્ફુના અનેકવાર પ્રસંગોમાં સાધુની ગોચરી અટકી નથી. ગોચરી જતા સાધુની સાથે પોલીસ સામે જઈ હેમઝેમ ઉપાશ્રયે પહોંચાડે. કફ્ફુનામાં પણ સાધુની રક્ષા માટે સમય આપતા આવા અમલદારોને પણ ધન્યવાદ છે.

જેણ સાધુ માત્ર એવું વ્યક્તિત્વ છે, જે પર્યાવરણની સંપૂર્ણ રક્ષાપૂર્વક પોતાનું જીવન જીવે છે. એકપણ જીવને પીડા ન આપવી અને જીવન જીવી જરૂર તે કેટલું અધરણ છે. તે વિચારશો તો તમને જેણ સાધુ આઠમી અજ્ઞાયબી લાગશે. જેની પાસે પોતાનું ઘર નથી, પોતાની જમીન નથી, સ્ની નથી કે બાળકો નથી. પોતાની કોઈ દુકાન કે વ્યવસાય નથી. જેને આવતીકાલે શું

ખાઈશું તેનું કોઈ આયોજન નથી કે તેની કોઈ દિવસ ચિંતા થઈ નથી !

જે માન-અપમાનમાં સમ છે. પરિષહો સહન કરવામાં રાજી છે. દેહનું દમન કરી આત્મપ્રાભિના ઉપાયોમાં તે રત છે. આ દુનિયાથી તે સાવ અલિપ્ન છે. જળકમળવત્ત જેનું જીવન છે. આવા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવાથી યાવત્ત કેવલશાન પ્રગતવા સુધીના લાભો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે.

સાધુ-સાધ્વીની સુંદર વૈયાવચ્ચ કરવા ખરેખર તો તેમના આચારો જાણવા જોઈએ. કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં (પર્યુષશાના) સાધુના ૧૦ આચારોની વાત આવે છે. તમે દર વખતે સાંભળો પણ છો. છતાં અવધારતા નથી. પ્રેક્ટીકલ આવે ત્યારે નાપાસ થઈ જાઓ છો.

સાધુને ગોચરી લેતાં ૪૨ પ્રકારના દોષો લાગવા સંભવ છે. તેમાં ૧૬ દોષો તો માત્ર તમારી અણાનતાના કે બેકાળજીના કારણે લાગે છે. તે ઉદ્ગમના દોષ કહેવાય છે. તમારા ધરમાં સાધુ આવે અને જો

આવો દોષ લાગે તો સાધુ ગોચરી લીધા વિના જ પાદા જાય. તમને અફસોસ થાય કે મહારાજ ૧૦ માળ ચડ્યા પણ કંઈ વહોર્યું નહિ ! પણ શું કરે ! તમને વહોરાવવાનું જીનું જોઈએ. બીજા ૧૬ દોષો સાધુથી જ થાય છે જેને ઉત્પાદના દોષ કહેવાય છે તથા બીજા ૧૦ દોષો એષણાના છે. આમ કુલ ૪૨ દોષ ન લાગે અને ગોચરી આવી જાય તે સાધુ માટે શુદ્ધ ગોચરી કહેવાય છે.

ધણા શ્રાવકો આવા ગીતાર્થ જેવા હોય છે, જે સાધુઓના આચારને જાણતા હોય છે. જેથી સાધુને જરાય દોષ ન લાગે તે રીતે સુપાત્રાદાન કરતા હોય છે. આવા જીવોને સુપાત્રાદાનનો વિશેષ લાભ મળે છે અને સાધુની સારામાં સારી ભક્તિ કરી શકે છે. આવા શ્રાવકો ઉપર સાધુઓ વિશેષ પ્રસત્ત હોય છે. તેનાથી તેનું ચારિત્રાવરણીય કર્મ તૂરે છે અને આ ભવમાં કે આવતા ભવમાં કલ્યાણકારી ચારિત્ર ઉદ્યમાં આવે છે.

સહજ ભવોદ્દેગ, ત્રીજું યોગબીજ :

જેને સંસાર પ્રત્યે ઉદ્વેગ ઉત્પસ થયો છે. કંટાળો ઉત્પસ થયો છે તેઓ આત્મા યોગબીજનો અધિકારી બને છે. આ ભવનો કંટાળો તે જ યોગબીજ છે.

જીવિયરાય સૂત્રમાં પ્રથમ પ્રાર્થના "ભવ્વનિવ્યોઓ"ની છે. હે પ્રભુ ! મને ભવનો નિર્વદ આપો. અર્થત્ આ સંસાર તરફથી મારી ચોઈસ, મારો રસ, મારું વલણ, મારી લાગણી ખતમ થાઓ ! સંસાર પ્રત્યે મને વૈરાગ્ય પ્રગટો ! વૈરાગ્ય એટલે



પાંચેય ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે વિરસતા ઊભી થવી તે વૈરાગ્ય. ટૂંકમાં વિષયો પ્રત્યે નિરસતા, કંટાળો, તે વૈરાગ્ય છે. પાપથી અટકી જવું તે વિરતી છે. વૈરાગ્ય આવે તો વિરતિ આવે.

આવો સહજ ભવોદેગ તે જીજું યોગબીજ છે.

ભવોદેગ આત્માની દિલ્લિ જ બદલી નાંખે છે. હમણાં સુધી ભોગદિલ્લિ હતી. જગતના બધાય પદાર્થો તેને ભોગવવા જેવા લાગતા હતા. તેમાં તેને જોવાની-માશવાની મજા આવવી હતી. હવે તેની દિલ્લિ યોગદિલ્લિ બનવા તરફ જાય છે. જેથી બધાય પદાર્થો ભોગવવામાંથી તેનો રસ ઉઠી જાય છે. જે જરૂરી, ઉપયોગી છે. તેટલા પદાર્થો પ્રત્યે કદાચ તેને મમતા હોય, રસ હોય, મજા હોય પણ બાકીના અનર્થક, જે જરૂરી નથી. ઉપયોગી નથી. તેવા પદાર્થો તરફથી તેનું બેંચાણ ચાલ્યું જાય છે. તેના ભોગવટાનો એરીયા, ભોગવશનો કાળ અને ભોગનો રસ બધું મર્યાદિત સિમીત થતું જાય છે.

ભોગકાળે તેની નિરસતા, ભોગ તરફનો કંટાળો, તિરસ્કાર તેના યોગબીજનું કારણ બને છે. જો તમારા આત્માની, તામારા મનની સ્થિતિ આવી ન હોય તો તમારા જીવને સમજાવી પ્રયત્નથી પણ ભવવૈરાગ્ય જીવનનમાં લાવવો જોઈએ.

ભોગના માત્ર સાધનોથી પાપ થતું નથી. સાધનો તો નિમિત્ત છે. તે સાધનોમાં તમારા રસથી પાપો બંધાય છે. આ રસ તોડી નાંખો એટલે પાપનો પાવર ડાઉન થઈ જાય. જીવને સમજવો કે અનાદિ કાળથી આ સંસાર વળણ્યો છે. તેમાં પ્રયુર ભોગોને ભોગવી આત્માને કાળોમેંશ કરવાના બંધા કર્યા છે. હવે જ્યારે જૈનકુળ મળ્યું છે. વીતરાગ પરમાત્મા મળ્યા છે. શાની-વૈરાગી ગુરુઓ મળ્યા છે અને આવી સમજ મળી છે તો સાવ પાપના પોતલા બંધાવનાર સંસારના રસને ઓછો કરતો જાઉ ! અને એકવાર સંકલ્પ કરો કે હવે સાદાઈથી જ જીવન જીવનું છે. નો જલસા ! વિષયોને ટૂંકા કરવા છે. ચોઈસને ટૂંકી કરવી છે. શોખને ટૂંકા કરવા છે. બસ જે મોટું કુંડાળું લઈને બેઠો છું તે કુંડાળાને હવે નાનું કરી નાંખું છે જેથી પાપો ઓછા બંધાય. દ્રવ્યથી પણ તમે આવું જીવન જીવશો તો ભાવથી વૈરાગ્ય જીવનમાં આવશો અને યોગના દ્વારો ખોલી નાંખશો. પ્રયત્નથી લાવેલો તમારો આ ભવોદેગ પછી આગળ જતાં સહજ બની જશે અને સંસારની પ્રવૃત્તિના સમયે આ ભવોદેગ તમને યોગબીજો મેળવી આપશે.

ભવોદેગ ઉત્પત્ત થતાં તમારામાં એક એવી ઉર્જા ઉત્પત્ત થશે કે પછી સામે આવેલા ભોગોમાં તમારું મન લલચારો નહિ. એવું સત્ત્વ પ્રગતશે કે ભલભલા નિમિત્તથી તમે બચી જશો. તમારી ઓરા એવી ફેલાશે કે, તમારા સંપર્કમાં આવનારને તમારા સાત્ત્વિધ્યમાં શોખ કરવાનું કે જલસા કરવાનું મન નહિ થાય. દીપ સે દીપ જલે. તમારા પ્રભાવે તમે બીજાને ભવોદેગ ઉત્પત્ત કરવાનું કર્ય કરશો. વધારે શું કહું ગણધર ભગવંતોએ કરેલી આ પ્રાર્થના છે. ભગવાન તમારા પ્રભાવથી મને ભવ વૈરાગ્ય

થાઓ !

સંસારમાં કંટાળો તો ઘણીવાર આવે છે. ઘરમાં કામ કરતાં કંટાળો આવે છે. છોકરાઓને ભણવા બેસતાં કંટાળો આવે છે. પાઠશાળામાં જવાનો કંટાળો, કોઈનું કઈ કામકરવાનું હોય તોય કંટાળો, દવા લેવાનો કંટાળો, સો ડગલા ચાલીને જવાનું હોય તો કંટાળો, કેટલાકને પૂજા કરવાનો કંટાળો આવે તો કેટલાકને નિયમ લીધા પછી પણ સામાચિક કરવાનો કંટાળો આવે. મોટાભાગે સંસાર રસીક જીવને ધર્મના વિષયોમાં કંટાળો આવે. આ કંટાળો તે ભવોદેગ નથી. આતો માત્ર પ્રમાદ છે. કામચોરી છે, હરામખોરી છે.

સંસારમાં પણ કેટલાંક કર્તવ્યો નિભાવવાના હોય છે. કેટલાક ઔચિત્યો જીવનવાના હોય છે. તેમાં કંટાળો આવે તો ન ચાલે. તેનાથી જીવન જ આખુંનિઝણ જાય.

કંટાળો વિષયોના ભોગવટા સમયે આપવો જોઈએ ! આયંબિલ કરવાની મજા આવે પણ ટેસ્ટફુલ ખાવાનું આવે ત્યારે ધર્મરસીક જીવને કંટાળો આવે. આયંબિલમાં મજા આવે તે અધ્યાત્મથે. જ્યારે ટેસ્ટફુલ ખાવાની મજા આવે તે સંસાર છે. ભવનો ઉદ્ઘેણ એટલે સંસારમાં જલસા કરવાનો કંટાળો.

આ કંટાળો એક અંદરી સમજ છે જે આત્મામાં આવી બેસી જાય છે કે જેનાથી ભોગો પ્રત્યે તેનું મન ધીમે ધીમે વિમુખ થવા લાગે છે. જલસા બંધ કરી સાદાઈથી જીવન જીવવાની અંદરથી જ પ્રેરણા થાય છે. સારું સારું ખાવાનું, સારું સારું પહેરવાનું, ઓઢવાનું, હરવા ફરવાનું, સિનેમા જોવાનું મનોરંજનના સાધનો રાખવાનું વગેરે તેને ગમતુંનથી. પહેલાં મોખાઈલ વિના ચાલું ન હતું હવે મોખાઈલ વાપરવાનો કંટાળો આવે છે. આ બધી કમાલ ભવોદેગની છે - ભવનિર્વદ્ધની છે.

સુરક્ષાકાવય, ચોથું યોગબીજ :

દ્રવ્યાનિગ્રહ પાલન : દ્રવ્યથી પ્રતનિયમો લેવા, પ્રતિશાઓ-બાધાઓ લેવી. તેનું પાલન કરવું.

પ્રતિશાઓ ચંચળ મનને બાંધવા માટે છે. મન જેનું છુટું છે, નિયંત્રિત નથી તેના માટે સંસાર ધૂટો છે. પ્રતિશાઓ આત્માનું બળ પ્રગતાવી મન-વચન-કાયાનું અશુભયોગોથી નિયંત્રણ કરી શુભયોગોમાં જોડે છે.

બાળકને દવાઓ જેમ પરાણે આપવી પડે છે તેમ મનને પણ પ્રતિશારૂપી દવાઓ પરાણે આપવી પડે. તેનાથી જીવનમાંથી પાપો જાય અને યોગ જીવનમાં આવે.

એક રાજકુમારાની વાત આવે છે. રીસાઈને ભાગી ગયો. જંગલમાં ડાકુઓનો સરદાર બન્યો. વંકચૂલ તેનું નામ હતું. બેફામ જીવન હતું. ક્યાંય કોઈ પ્રતિબંધ નહિ.

એકવાર કોઈ સાધુ જંગલમાંથી પસાર થતા હતા. તેની પલ્લીમાં આવી ચાતુર્માસના ચાર મહિના અહીં ગાળવા માટે જગ્યા (વસતિ) માંગી. વંકચૂલને થોડોક અહોભાવ થયો.



લિ. હેમરતનસૂરી...

પ્રિય અક્ષય ! ધ્રુવ નીકળી ગયા પછી માણસને પાછી વાળવાનું કામ અતિ મુશ્કેલ બની જાય છે. કહેવાય છે કે શત્રુને તો ઉગતો જ ડામવો જોઈએ. પહેલેથી જો પાનમસાલાથી જ માંડવાન કરવામાં આવે તો આગળની વિકટ પરિસ્થિતિમાંથી ઉગરી શકાય છે.

જુવાનીમાં માણસને લોહી બહુ ચટકા ભરતું હોય છે. હાથી જ્યારે જુવાનીમાં આવે ત્યારે તેના ગંડસ્થળમાંથી મદ જરૂર છે. તેમ માણસ જ્યારે જુવાનીમાં આવે ત્યારે તેના મનમાં પણ મદ જરવા મંડે છે અને માણસનું મન ઉન્મત બને છે. આવી સિથિતિમાં જો સારું કાર્ય હાથમાં આવી જાય તો માણસ કામ કરી બતાડે. નવી તાજી સંપ્રામ થયેલી યુવાશક્તિને સત્કાર્યનો રાહ ન જરૂર તો એ અવળો માર્ગે ફંટાઈ જાય અને કશુંક હતું ન હતું કરી નાંબે.

આને ઈંગ્લીશમાં ‘ટ્રાન્સફર્મેશનક ઓફ એનજી’ કહેવાય છે. તમારી અંદર ઉભરાતો શક્તિને જો કોઈક સાથે કાર્યમાં જોડી દેશો તો વિનાશકારી નાપાક ફૃત્યોથી તમે બચી જશો, પણ જો જુવાનીમાં કશુંક સત્કાર્ય હાથ પર નહિ ધરો. વ્યસની, ગંજેરી, બંજેરી બની જવાના.

અમેરિકામાં જેકી અને પેકી કહેવાય એવા લાયક યુવાનો રહ્યે છે. ભારતમાં પણ આવા ગંજેરીઓની સંખ્યા ઓછી નથી, એકલા મુંબઈમાં જ બે લાખ બંધાડીઓ હોરની જેમ રજીની રહ્યાં છે. સુરતમાં આવાં કેટલાં રહ્યે છે. તેની ગણતરી હજી જ્ઞાણવા મળી નથી. પણ નાનપુરા વિસ્તારમાં એક પાનના ગલ્લવાળો રોજના ૩,૫૦૦ પાનપરાગના પાઉચ વેચે છે. અઠવાગેટથી માત્ર એક અંબાજી રોડ પર ત જેટલી પાનવાળાની લારીઓ છે. તે લોકો અંદાજે રોજના ૨,૫૦૦ પરીકા વેચી મારે છે. આ સાદા પરીકાં કરતાં જરૂર્યુક્ત પરીકાનું વેચાણ વીસ ગણ્યું વધારે છે. હીરા બજારમાં કેટલાક એવા નામદાર છે કે જ્યારે જુઓ ત્યાં તેમનો થોખરો પાનપરાગથી જ ભરેલો હોય. આ નામદાર મહેરખાનને બધા ‘પરાગ’ ઉપનામથી બોલાવે છે.

તમારા સુરતમાં ધોરણ નવમામાં ભાષાતો. એક મેહુલ નામનો બાળક છે. તે મહિનામાં ખાલી ૧૦૦૦ રૂ.નું તું પાનપરાગ જ ખાય છે. એક જૈન ફેમીલીમાં બાપની આદતના કારણે પત્ની આદતનો ભોગ બની અને એક પત્નીના કારણે બાળકો પણ વસનના ભોગ બન્યા. આવું આખું ઘર પાનપરાગનું એડીક્ટેડ બન્યું છે. બધાં ભેગા મળીને રોજના વીસેક પરીકાં ઉડાવી જાય છે.

ડૉ. એ.લ. પી. શાહ પાસે એક એવા વેપારીનો કેસ આવેલો, જે દિવસમાં પાનપરાગના વીસ ડબ્બા ખાલી કરતા. એમાં થોડુંક મહેમાનોને ડૉનેશન પણ કરતાં હતાં.

વ્યસનોના મલકમાં સૌથી ખતરનાક જો કોઈ ચીજ હોય તો આ પાનપરાગ, કેમ કે બ્રાઉનસુગર, હેરોઈન કે શરાબ શરૂ

કરતાં તો માણસ ગભરાય છે. એના સેવનમાં તો કોક ખૂંઝો શોખવો પડે છે. પકડાઈ જવા નો ડર લાગે છે. પણ પાનપરાગ વગરે એવી ચીજ છે કે જેનો જાહેરમાં ખુલ્લેઆમ ઉપયોગ કરી શકાય છે. સગાબાપની સામે પણ ખાઈ શકાય છે. ખૂદ પણ્યાઓ પણ ક્યારેક એક પરીકીના હિન્હુસ્તાન, પાકીસ્તાન જેણા બે વિભાગ કરીને બાપ દીકરા બેધ અડધી અડધી વહેંચી લેતા હોય છે. ને રોકટોક આ વ્યસન સેવી શકાય છે. તરતમાં તેની કશી આડઅસરો દેખાતી નથી. એટલે માણસને કંઈ જોખમ જેવું નથી લાગતું. પણ નોંધી લો કે સૌથી વધારે ખતરનાક જુદા જુદા નામે વેચાતી આ પરીકીઓ છે. તમે જે દિવસથી આ પરીકીઓએ ચાવવાની શરૂઆત કરી હોય તે શુભ (!) દિવસથી વીસ વર્ષ પછીની જે તારીખ આવતી હોય તે તમારા માટે કેન્સરના શુભાર્થભંની ટેટ બની શકે છે. કેન્સર પોતાના આગમનની જીહેરાત મોઢામાં ચાંદા પડવા દ્વારા કરે છે. મોંમાં ચાંદા પડે કે મોં સુકાવા લાગે કે મોંમાંના સ્નાયુઓ સ્ટીફ થવા મંડે અને મુખ પૂરા પ્રમાણમાં ખુલતું બંધ થઈ જાય એટલે સમજવું કે કેન્સર પોતાના આગમનની છદી પોકારી રહ્યું છે. દર્દીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ આવે ત્યારે તો રોગ ત્રીજા સ્ટેપમાં હોય છે કે જ્યાંથી પાછી તંદુરસ્તી લાવી શક્ય ન હોય. જ્ઞાના પાછળના ટીસ્યુને ઈજા થાય. ટીસ્યુ જરૂર થવા મંડે. તેને મેડીકલ ભાષામાં સબમ્યુક્સ ફાઇઝ્ઓસિસ કહેવાય છે. આને પ્રિકેન્સર કડીશન કહેવાય છે એટલે કેન્સરના આગમનની પૂર્વભૂમિકા કહેવાય છે.

તમારો સ્વભાવ ચીડીયો બનવા મંડે, તમને એકલા પડ્યા રહેવાનું મન થાય, ભૂખ મરી જાય, વારેવારે ગુસ્સો અને ઉશ્કેરાટનો અનુભવ થાય ત્યારે સમજવું કે શરીરમાં કોક ગંભીર ફેરફારો થઈ રહ્યાં છે, જે કેન્સર તરફ તમને દોરી રહ્યા છે.

ટાટા હોસ્પિટલના બધા યુનિટોમાં દર વર્ષે પાનમસાલા ખાનારા પઠ થી ૬૦ કેસ આવે છે. રાજકોટની પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં કેન્સરના દર સો માંથી ૭૦ કેસ માત્ર વ્યસનોના કારણવાળા હોય છે.

આ મસાલા ચંગળાં ચંગળાં ગાલફોરામાં કેન્સર થાય છે. એની ચાંદી એટલી મોટી પડે છે કે કદાચ કોણીયો મોં ના બદલે ગાલવામાં પડેલા કાણામાંથી પસાર કરવો હોય તો થઈ જાય. આવી અનેક પ્રકારની ઉપાયિઓ એક માત્ર મામુલી શોખ ખતર આવીને ઊભી રહે છે. ઘણા યુવાનો કશી સમજણા વિના માત્ર શોખ ખતર અને ફેન્ડસર્કલમાં નીચું ન જોવું પડે માટે પરીકીઓ ચાવતા હોય છે.

મારે તમને એ કહેવું કે, જે સર્કલમાં રહેવા માટે શરીરનું નખ્ખોદ કાઢી નાખવું પડતું હોય તે સર્કલને તમે આજે ને આજે તોડી નાખો. તમે બધાં નક્કી કરો કે કોઈ પણ જાતની પરીકી, સીગરેટ કે તમાકુ કોઈપણ પ્રકારનો વ્યસની આપણા સર્કલમાં જોઈએ નહિ. જે છોડવા તૈયાર ન હોય તેને સર્કલમાંથી ઉચ્ચિતીને બહાર ફેંકી દો અને પ્રદૃષ્ટામુક્ત એક નવા કેશ ફેન્ડ સર્કલનું નિર્માણ કરો. જેમાં એક પણ વ્યસની લલ્લુન હોય.

## આતમ ઝંપે છૂટકારો...

### પમું આવશ્યક કાયોત્સર્ગ

‘મન્દિર જિયાંસ’ શ્રાવકના ઉહ કર્તવ્યો પૈકી પડુ આવશ્યકની વાત ચાલે છે. પ્રતિકમણ આવશ્યકની વાત થઈ. હવે ‘કાયોત્સર્ગ’ નામનું આવશ્યક કેવી રીતે આરાધવું તેની વાત કરવી છે.

‘કાઉસ્સંગ’ આ પ્રાકૃત શબ્દ છે. તેનો સંસ્કૃત શબ્દ છે. ‘કાયોત્સર્ગ’ કાયાનો ઉત્સર્ગ. કાય એટલે શરીર ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. એટલે કાયાનો ત્યાગ કરવો આ શબ્દાર્થ છે. કાયોત્સર્ગ તે પારિભ્રાષ્ટક શબ્દ છે. શબ્દાર્થ ઉપર મુજબ છે પરંતુ કાયોત્સર્ગ એટલે અમુક પ્રકારના ધ્યાનમાં રહેવું તે છે. અમુક સમય સુધી કાયોત્સર્ગની મુદ્રામાં ઊભા રહી અથવા બેસીને કે સૂતા સૂતા ધ્યાન કરવું તે કાયોત્સર્ગની ત્રણ મુદ્રા છે.


આ ત્રણ પ્રકાર છે. (૧) આર્ત-દૌરધ્યાન કરવું. (૨) કંઈપણ ન કરવું. (૩) ધર્મ-શુક્લ ધ્યાન કરવું. આમ ત્રણ પ્રકારે ગુણતાં કુલ ૮ પ્રકારના કાયોત્સર્ગ થાય છે. અહીં ધર્મ-શુક્લ ધ્યાનવાળા કાયોત્સર્ગ સમજવાના છે આવશ્યક નિર્યુક્તિના માનના ગ્રંથમાં આ પ્રકારો બતાવ્યા છે.

પાપના પ્રાયશ્ચિત્તા રૂપે અથવા આરાધના રૂપે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તે સિવાય સમકિતી દેવોને બોલાવવા અથવા દેવોની પ્રસંગતા માટે, સહાય કરે તે માટે કાયોત્સર્ગ કરાય છે.

કાયોત્સર્ગ ધ્યાનમાં પણ મોટું સાયન્સ છે.

જેમાં મન-વચન અને કાયા આ ત્રણોની એકાગ્રતા થાય છે. એટાંગ યોગમાં આ બધી વાતો આવે છે. જેને ધ્યાનના રસ્તે જવું હોય તેણે એટાંગયોગ સાધવો પડે છે. ધર્મ-નિયમ-આસાન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ.

આમાં ધ્યાનનો ઉમો નંબર છે. ધ્યાનમાં જતાં પહેલાં આગળના છ યોગોનો અભ્યાસ કરી સ્થિર કરવામાં આવે તો ધ્યાન સુખપૂર્વક થાય છે. ‘ધર્મ’ એટલે પ મહાક્રત અથવા પ અણુવત અથવા જેનેતરોમાં જે આચારો પ્રસિદ્ધ છે તે આચારોનું પાલન જેના જીવનમાં હોય. ત્યારબાદ તે વ્રતની સુરક્ષા માટે નિયમો જીવનમાં પળાતા હોય. ટૂંકમાં જેઓનું જીવન અન્યંત નિયમિત અને નિયંત્રિત હોય. ત્યારબાદ ‘આસન’ એટલે ધ્યાનમાં એક જ મુદ્રામાં વધારેમાં વધારે સમય સ્થિરતાપૂર્વક બેસી શકાય અથવા ઊભા રહી શકાય તેનો (અમુક આસનોનો) અભ્યાસ કરવાથી આસનની સિદ્ધિ થાય. કારણ ધ્યાનમાં શરીર ઉપયોગી છે. જો શરીરમાં સુરક્ષા, કંપન કે હલનયલન હોય તો મનમાં આવતા વિચારોનો ફ્લો અટકાવવો મુશ્કેલ બને. શરીર



નિષ્ઠપ હોય, પદ્માસન કે પલાંઠી વાળેલી મુદ્રામાં જરાપણ હલ્યા-ચાલ્યા વિના બેસી શકાય તો જ મન ધીરે ધીરે એકાગ્રતા સાધી શકે અને આવો અભ્યાસ થવાથી જીગૃત મન અધ્યજીગૃત મન સાથે જોડાઈ સમાધિ નામના આઠમા યોગને પ્રાપ્ત કરી શકે. આ પ્રાથમિક વાતો છે.

આવું ધ્યાન ઉપર બતાવું તે ઉ મુદ્રામાં થઈ શકે છે. જૈનર્ધનના આ ‘કાયોત્સર્ગ’ યોગનું લક્ષ્ય કર્મનિર્જરા કરવા દ્વારા આત્મશુદ્ધિ કરવાનું છે. આત્મશુદ્ધિ થતા અંતે કેવલજ્ઞાન અને જીવનમુક્તિની પ્રાપ્તિ છે.

મન-વચન અને કાયા જ્યાંદે અન્યંત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ત્યારે કહેવાય છે કે આત્માનું સુરક્ષા-કંપન નહીંવતું બને છે. જેના કારણે આત્મા તરફ રાગ-દેખના સતત પરિષામોના કારણે બેંચાઈને આવતી કર્મરજો આત્માને ચોટતી બંધ થાય છે.

શાસ્ત્રીય ભાષામાં આત્મા તે વખતે ખૂબ જ અલ્ય કર્મબંધ કરે છે અને સામે ઉપશમ નામનો ભાવ

(સમતા)નો આવિભર્વિં થવાથી જુના બંધાયેલા કર્મો આત્મામાંથી ઉખડીને ખરવા લાગે છે. જેને જૈન શાસ્ત્રીય પરિભાષામાં કર્મોની ‘નિર્જરા’ થાય છે એમ કહેવાય છે. કર્મોનું આત્મા સાથે બંધાવું - ચોટવું તે આશ્રવ-કર્મબંધ અને છૂટવું - ખરવું તે કર્મનિર્જરા કહેવાય છે. આમ કાયોત્સર્ગ કરવાથી આત્મ શુદ્ધિ થાય છે.

‘કાયોત્સર્ગ’ જે આવશ્યક તરીકે મૂક્યું છે તેની વાત અહીં કરીએ. ધ્યાનની વાત ધણી લાંબી છે. તે વિષય પણ ગહન છે. પૂર્વે મુનિયો, સાધકો આવું કાયોત્સર્ગ ધ્યાન કરતાં જેમાં સાલંબન અને નિરાલંબન બે પ્રકારના ધ્યાન હતા. શરૂમાં સાલંબન એટલે કે કોઈક પદાર્થ, અસ્ત્ર, ચિત્ર વગેરે શુભનું આલંબન લઈ તેના ઉપર ધ્યાન કરતા. છેલ્લે આવા કોઈ આલંબન વિના માત્ર સ્વાત્માનું ધ્યાન કરતા. પરંતુ તે વિષય અહીં લેતો નથી.

પહેલાં તો કાયોત્સર્ગ કરવા શરીર અને મુદ્રાનો વિચાર કરીએ કે કાયોત્સર્ગ ઊભા ઊભા કરવો હોય તો કેટલો સમય કરી શકાય? કાયોત્સર્ગ વખતે ઊભા રહેવાની પણ પદ્ધતિ છે અને આ પદ્ધતિ બિલકુલ સાયન્ટિફિક છે. જેમાં જ્યારે ઊભા રહેવાનું છે ત્યારે બે પગના અંગુઠા વચ્ચે માત્ર ચાર અંગુઠનું અંતર જોઈએ અને પાછળ બને એડી ચાર અંગુઠથી ઓછા અંતરે રહે તેવી રીતે રાખવી જોઈએ. એટલે તમારા બને પગ તમારા શરીરને ઉંચકવા બેથાંભલાનું કાર્ય કરશે.

હવે તમારે શરીરને સીધી રૈખામાં રાખવાનું છે. રસ્ટ્ર

રાખવાનું છે. મસ્તક પણ નમેલું નહિ તેમ સીધું રાખવાનું છે. હવે તમારા શરીરની બેલેન્સનું મધ્યબિંદુ તમારી નાભિમાં આવશે. એટલે જો વ્યવસ્થિત (વિકૃત નહિ તેવું) શરીર હશે તો શરીરનું તમામ વજન મધ્યબિંદુ ઉપર બેલેન્સ થવાથી તેનો ભાર પગ ઉપર નહિ આવે. તેથી એક કલાક કે આખી રાત્રિ સુધી પણ ઊભા રહેવાથી તમને થાક નહિ લાગે પણ આ જ મુદ્રામાં ઊભા રહેવું પડે.

નટો, કલાકારો વગેરે એક પગ ઉપર પણ શરીરની બેલેન્સ કરી ઊભા રહે છે. માથા ઉપર ભાર હોય કે હાથમાં શસ્ત્રો હોય છતાં થાક લાગતો નથી. આ બધું ક્યારે બને? જો તમે આવો અભ્યાસ પાડો તો! ૧૦૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવા છતાં તમને શ્રમ ન લાગે અને વારંવાર આવા કાયોત્સર્ગ કરવાનું મન થાય.

આ થઈ મુદ્રાની વાત. આવી મુદ્રાને પણ કાયોત્સર્ગ મુદ્રા કહેવાય છે. પ્રતિકમણ કરતાં આવા કાયોત્સર્ગ આવે છે. ત્યારે ઊભા ઊભા કાયોત્સર્ગ કરવાના હોય છે. આવું કાયોત્સર્ગ ધ્યાન તે આત્મશુદ્ધિનું - કર્મનિર્જરાનું બળવાન શસ્ત્ર છે. બળવાન યોગ છે.

કાયોત્સર્ગ અમુક આરાધના માટે પણ કરાય છે. જેમ કે 'શ્રી સિદ્ધગિરિ મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સાગ્ન' એટલે સિદ્ધગિરિજાળની આરાધના માટે ૬ લોગસ્સ કે અમુક લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે. જેનાથી મહાતીર્થ શરૂંજયની આરાધના થાય છે. તે રીતે 'અરિહંત ચેરીયાંશ' એટલે અરિહંત પરમાત્માના ચૈત્ય (જિનાલય)ની આરાધના માટે કાયોત્સર્ગ, 'શ્રુતોપદ્રવ ઉદ્ઘાવણ કરેમિ કાઉસ્સાગ્ન' ઉપદ્રવનો નાશ કરવા પણ કાયોત્સર્ગ થાય છે.

સુદર્શન શેઠ કરેલા કાયોત્સર્ગ કેવી કમાલ કરેલી? રાજગૃહિ નગરીની વાત છે. એક અર્જુન માળી કરીને કુલો વેચનાર માળી હતો. તેના શરીરમાં કોઈ બળવાન યક્ષે પ્રવેશ કર્યો (ભૂત વળયું) સાદો સીધો માણસ યક્ષના બળથી લોકોના ખૂન કરવા લાગ્યો. હાથમાં મુદ્રગર (એક પ્રકારનું તીક્ષ્ણ શસ્ત્ર) લઈ સવારમાં જ ઘરેથી નીકળી પડતો. જ્યાં સુધી તે સાત જણાના ખૂન ન કરે ત્યાં સુધી યક્ષ શાંત થતો ન હતો. લોકો તેને જોઈ ભાગી જતા. જ્યાં સુધી સમાચાર ન મળે કે તેણે સાત હત્યા કરી છે ત્યાં સુધી લોકો પોતાના ઘરનો દરવાજો બંધ રાખતા.

એકવાર એવું બન્યું કે ભગવાનની દેશના સાંભળવા સુદર્શન શેઠ પોતાના ઘરેથી નીકળ્યા, સવારનો સમય હતો. શેઠ અડધે રસ્તે પહોંચ્યા ત્યાં તો લોકો દોડતા દોડતા તેમની તરફ આવી રહા હતા. ખૂબ કોલાહલ સંભળાતો હતો. લોકોએ શેઠને કહ્યું, 'પાછા વળો પેલો અર્જુન માળી આવી રહ્યો છે. રોજ સાતની હત્યા કરે છે! શેઠ સંકલ્પ કરીને નીકળ્યા હતા. વિચાર

કર્યો કે, હવે પાછા કેમ જવાય? દેશના તો સાંભળ્યા વિના કેમ રહેવાય? એક બાજુ સંભવિત હત્યા બીજી બાજુ પ્રભુની દેશના સાંભળવાનો નિયમ! જે થાય તે સાંદું, જવા હો "સાત્ત્વિક પુરષોના ચરણોમાં સિદ્ધિઓ સામેથી આવી મળે છે!"

શેઠ આગળ વધ્યા ત્યાં તો પેલો વિકરાળ મુખ કરતો મુદ્રગર ચારે દિશામાં ઉછાળતો ઉછાળતો આગળ ધસી રહ્યો હતો. શેઠ જોયું હવે જો મોત આવવાનું જ છે, તેઓ 'અરિહંતે શરણં પવજજામિ' કહી કાયોત્સર્ગ ધ્યાને સ્થિર બની ગયા. 'ઢાંણાં મોણેણાં જાણેણાં અખ્યાણાં વોસિરામિ' કહી ધ્યાનમાં ગયા. પેલો અર્જુન માળી ધસમસતો આવ્યો ખરો પરંતુ શેઠની નજીક આવતાં જ શાંત પડી ગયો. ચકળવકળ આંખે જોવા લાગ્યો. શેઠની શાંત-પ્રશાંત મુદ્રા જોઈ તેના હાથમાંથી મુદ્રગર પડી ગયું. થોડીકિ વારમાં તો શેઠના ચરણોમાં પડ્યો. શેઠ જોયું કે તેનામાંથી ભૂત ભાગી ગયું છે? શેઠ કાયોત્સર્ગ પારી ઊભો કરી તેને પણ સાથે પ્રભુની દેશનામાં લઈ ગયા! કમાલ તો એ થઈ કે દેશના સાંભળતાં અર્જુનને પોતાના પાપનો ભારોભાર પછીતાવો થયો. પ્રભુ પાસે દીક્ષા લઈ સાધુ બની ગયો. ગામ બહાર કાયોત્સર્ગ ધ્યાન ઊભો રહેતો ત્યારે ગામવાળા લોકો આ હત્યારો છે. તેમ કહી પથ્થરો મારવા માંડ્યા. શાસ્ત્ર લખે છે કે, તેણે જ મહિના સુધી લોકોના ત્રાસ (ઉપસર્ગ) સહન કરી કેવળજ્ઞાન મેળવી મોક્ષે ગયો. ભગવાન બની ગયો.

આ પ્રસંગને તમે વિચારો! શું બન્યું? સુદર્શન શેઠ સાત્ત્વિક પુરુષ હતા. તહુપરાંત પ્રભુના પરમભક્ત હતા. તેથી તેમને કોઈનો ય ભય ન હતો. મોતનો પણ નહિ! કાયોત્સર્ગ કરવાથી તેમના અંતરાત્મામાં અતિશુભલેશ્યાનું નિર્માણ થયું અને તેમના શરીરમાંથી અત્યંત શુભ ઓરા વહેવા લાગી તે ઓરામાં અર્જુન આવ્યો એટલે તેનામાં રહેલ અશુભ તત્ત્વ ત્રાસ પામી નીકળી ગયું! આ છે કાયોત્સર્ગનો પ્રભાવ.

તમે કાયોત્સર્ગ કરો એટલે તમારી આસપાસ ઓછામાં ઓછા સાદા ત્રણ હાથ વધુમાં તેથી વધારે પણ ઓરા સર્કલનું નિર્માણ થાય છે. તે ઓરા સર્કલમાં અશુભ તત્ત્વો પ્રવેશી શકતાં નથી. પ્રવેશો તો શાંત બની જાય છે. આજના સાયંસે આ બધું સાબિત કરી દીધું છે. ધર્મ માત્ર આસ્થા કરવા પૂરતો નથી. ધર્મ હવે પરા વિજ્ઞાન બની ચૂક્યું છે. જૈનદર્શનમાં બતાવેલો કિયાયોગ તે તમામ પરાવિજ્ઞાન બની ચૂક્યું છે. તેમાંથી આત્માની અને શરીરની સુરક્ષા કવચયાનું નિર્માણ થાય છે.

પૂણિયો શ્રાવક સામાયિક કરતો ત્યારે કહેવાય છે કે, તે એક એવા સુખની અનુભૂતિ કરતો જે સુખને સંસારના કોઈપણ ભૌતિક સુખ સાથે સરખાવી શકાય તેવું નથી. તેનું કટાસણું સિદ્ધશીલા બની જતું અને ખુદ મોક્ષસુખની અનુભૂતિ કરતો.

અહીં કાયોત્સર્ગ નામના પમા આવશ્યકની વાત ચાલે છે.

અનુસંધાન પાના નં. ૧૦ ઉપર

યુવાહદય સમાદ્દ પૂ.આ.શ્રી હેમરતનસૂરીશ્રાજુ મહારાજાના શિષ્યરત્ન પૂ.મુનિશ્રી હૃદયરત્ન વિ.મ.ની પંન્યાસ પદવીનો કાર્યક્રમ શાનપંચમીના પાવન દિવસે સંયમૈકલક્ષી પૂ.આ.શ્રી જગચંદ્રસૂરીશ્રાજુ મહારાજાની પાવન નિશ્રામાં શ્રી જૈનગર જૈન સંધમાં થવા પામ્યો હતો.

આ પ્રસંગે નવકારશ્રી સંધમાંથી પ્રવચન શિખર પૂ.આ.શ્રી મહાલોધિસૂરીશ્રાજુ મ. તથા પૂ.પંન્યાસશ્રી પ્રેમસુંદર વિજયજુ મ., પૂ.મુનિશ્રી અધ્યાત્મરત્ન વિ. આદિ પધાર્યા હતા. જૈન મરચન્ટ સો.સા.થી પૂ.મુનિશ્રી ધમગ્રેમ વિ.મ. આદિ પણ પધાર્યા હતા. શ્રીસંધમાં શાનપંચમીની આરાધના પૂર્ણ થતાં સવારે ૮-૩૦ કલાકે પદવીનો કાર્યક્રમ શરૂ થયો હતો.

પ્રાથમિક વિવિધ બાદ પૂજય મુનિશ્રીને વિદ્યામંત્રનો પટ વહોરાવવાનો લાભ તેઓના સુરતથી આવેલા સ્વજનોને, નવકારવાળી શ્રી સેટેલાઈટ સંધને, ઓઘાની દાંડી મુનિશ્રી હેમરતન તથા મુનિશ્રી નેમર્થિરતના સ્વજનોને તથા આસન એલર્ટ ચુપના યુવાનોને વહોરાવવાનો લાભ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂ.મુનિશ્રીને બાયપાસ વખતે ખૂબ સેવા કરનાર સાધુ-સાધી વૈયાવચ્ચી તથા શ્રમણ સેવા ટ્રૂસ્ટમાં કાર્ય કરતા એલર્ટ અજ્યાભાઈનું એલર્ટ ચુપ ઓફ ઇન્નિયા તરફથી શાલ ઓઢાઈ તથા રૂ.૨૫૦૦૦નું કવર આપી શ્રી કલ્યેશભાઈ, શ્રી જ્યોશભાઈ ભણશાલી આદિએ બહુમાન કર્યું હતું.

મંત્ર સંભળાવવાનું મુલ્લૂર્ત-સમય આવતાં પૂજય આચાર્યદેવ પાટ પર પધાર્યા હતા. વિવિધપૂર્વક મુનિશ્રીને પંન્યાસપદનો મંત્ર સંભળાવી નૂતન પંન્યાસ તરીકે નામ સ્થાપન કર્યું હતું.

આ પ્રસંગે માતૃહદયા પૂ.સા.શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી, પૂ.સા.શ્રી મંદિરનિધિશ્રીજી, પૂ.સા.શ્રી મૃહુર્વર્ધનાશ્રીજી, પૂ.સા.શ્રી કૃતાર્થનિધિશ્રીજી, પૂ.સા.શ્રી કીર્તિપૂર્ણાશ્રી (ડીસાવાળા)નો પરિવાર, પૂ.ભક્તિસૂરી મ.ના પૂ.સા.શ્રી વિનયરત્નાશ્રીજી મ. આદિ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂ.મુનિશ્રીના સ્વજનો સુરત-મુંબઈ વગેરે સ્થળેથી પધાર્યા હતા. અમદાવાદથી એલર્ટ ચુપના સરસેનાવિપત્તિ શ્રી કલ્યેશભાઈ, જ્યોશભાઈ આદિ, નાશિક ચુપમાંથી શ્રી રાજનભાઈ પરીખ તથા બ્રાહ્મી-સુંદરી ચુપની આમંત્રિત બહેનો પણ ઉપસ્થિત રહી હતી. સેટેલાઈટ શ્રીસંધનું ટ્રૂસ્ટીમંડળ, શ્રી જૈનગર સંધના ટ્રૂસ્ટીભાઈઓ, વિસનગર શ્રીસંધના, હિમતનગર જૈન સંધના ટ્રૂસ્ટીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પૂ.મુનિશ્રી દાનપ્રેમવિજયજુ મહારાજે એલર્ટ સરસેનાવિપત્તિશ્રી જ્યોશભાઈ તથા શૈલેખભાઈ આદિને માર્ગદર્શન આપી પદવી પ્રસંગની તમામ વ્યવસ્થા સંભાળી હતી. શ્રીસંધના ટ્રૂસ્ટીમંડળે સુંદર સહયોગ આપ્યો હતો.

આવનાર ભાવિકોને ૨૫૦ રૂ.ની પ્રભાવના કરવામાં આવી હતી. આવનાર મહેમાનો માટે શ્રી સેટેલાઈટ સંધમાં તથા સુકૃત સેન્ટરમાં ભોજનની ત્રણે ટાઈમની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ શ્રી સેટેલાઈટ સંથે લીધો હતો.

### પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીની પ્રથમ પુણ્યતિથિ

સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી જયદીપસૂરીશ્રાજુ મહારાજાને વિ.સ. ૨૦૭૭, કા.વ. ૧ની પ્રથમ પુણ્યતિથિએ એલર્ટ ચુપતરફથી ઉત્કૃષ્ટ ભાવાંજલિ આપવામાં આવી હતી.

પૂજયપાદશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૈન એલર્ટ ચેરીટેબલ ટ્રૂસ્ટ તરફથી પૂજયશ્રીની અભિનસંસ્કાર ભૂમિ અમદાવાદ - આંબલીના સમાધિ સ્થાને સમસ્ત રાજનગરના પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓનું અંદાજે ૮૪ લાખ (પૂજયશ્રીના ૮૪ વર્ષના ઉપલક્ષમાં)નું ઉત્કૃષ્ટ સન્માન-ભક્તિ કરવામાં આવી હતી.

એલર્ટ ચુપ ઓફ મુંબઈ તરફથી પૂજયપાદશ્રીના ૮૪ વર્ષ આયુષ્યાના ઉપલક્ષમાં ગુજરાત-રાજ્યસ્થાન-મહારાધ્રની ૮૪ પાંજરાપોળોને પ્રત્યેકને ૧-૧ લાખ રૂ. દ્વારા કુલ ૮૪ લાખ રૂ.નું અનુદાન એલર્ટ નિલેખભાઈ, એલર્ટ જિનેશ દોપી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

આજના કા.વ. ૧ના દિવસે સમાધિસ્થાન આંબલી-અમદાવાદ સહિત સમુદ્દરાયના ૧૦૦ ઉપરાંત સાધુ ભગવંતોના ચાતુર્માસ સ્થળે તથા અનેક સાધીજી ભગવંતોના ચાતુર્માસ સ્થાનોમાં પૂજયોની પ્રેરણાથી એકથી લઈ પંચાલ્લિક મહોત્સવો, વિવિધ આરાધનાઓ, જાપ, અનુકૂલાદાન, જીવદયા, સાધીમેંકભક્તિ, જિનાલયોમાં લાભેણી આંગી, વકૃત્વ સ્પર્ધાઓ, નાટિકાઓ, ગુણાનુવાદ સભાઓ, સામુહિક આંબિલ વગેરે અનેક પ્રકારના આયોજનો કરી દેશ-વિદેશમાં પૂજયશ્રીને મુઢી ઉંઘેરો પરિયય લોકોને કરાવવામાં આવ્યો હતો.

જોકે કોરોનાની વધતી અસરના કારણે અનેક સામુહિક કાર્યક્રમો-મિલનો વગેરે મુલત્વી રખાયા હતા. આ નિમિત્તે શ્રી સંધો-ટ્રસ્ટો તરફથી કરોડો રૂપિયાના દાન વિવિધ ક્ષેત્રમાં ફાળવવામાં આવ્યા હતા.

સમુદ્દરાયના પ્રત્યેક સાધુ-સાધીના હદયમાં વસી ગયેલા પૂજયપાદશ્રીને પ્રત્યેક સાધુ-સાધીજી ભગવંતોએ અશ્વુભીની અંજલિ રૂપ વિવિધ તપશ્ચર્યાઓ કરી હતી.



સંસારમાં ધણાય કષ્ટો વેઠો છો, તેનાથી કોઈ આત્મીય ગુણ થતો નથી. ધર્મ અને ધર્મકિયામાં વેઠેલા કષ્ટો આત્મગુણોને ઉત્પન્ન કરે છે.



યુવાહદ્ય સમાદ્દ પૂ.આ.શ્રી હેમરતનાસૂરીશરજી મહારાજાના શિષ્યરત્ન પૂ.મુનિશ્રી હૃદયરત્ન વિ.મ.ની પંન્યાસ પદવીનો કાર્યક્રમ જ્ઞાનપંચમીના પાવન દિવસે સંઘમૈકલક્ષી પૂ.આ.શ્રી જગયંત્રસૂરીશરજી મહારાજાની પાવન નિશ્ચામાં શ્રી જૈનગર જૈન સંધમાં થવા પામ્યો હતો.

આ પ્રસંગે નવકારશી સંધમાંથી પ્રવચન શિખર પૂ.આ.શ્રી મહાબોધિસૂરીશરજી મ. તથા પૂ.પંન્યાસશ્રી પ્રેમસુંદર વિજયજી મ., પૂ.મુનિશ્રી અધ્યાત્મરત્ન વિ. આદિ પધાર્યા હતા. જૈન મરયન્ટ સો.સા.થી પૂ.મુનિશ્રી ધર્મગ્રિમ વિ.મ. આદિ પણ પધાર્યા હતા. શ્રીસંધમાં જ્ઞાનપંચમીની આરાધના પૂર્ણ થતાં સવારે ૮-૩૦ કલાકે પદવીનો કાર્યક્રમ શરૂ થયો હતો.

પ્રાથમિક વિધિ બાદ પૂજ્ય મુનિશ્રીને વિદ્યામંત્રનો પટ વહોરવવાનો લાભ તેઓના સુરતથી આવેલા સ્વજનોને, નવકારવાળી શ્રી સેટેલાઈટ સંધને, ઓધાની દાંડી મુનિશ્રી હેમરતના તથા મુનિશ્રી નેમર્ધિરતના સ્વજનોને તથા આસન એલર્ટ ગુપના યુવાનોને વહોરવવાનો લાભ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂ.મુનિશ્રીને બાયપાસ વખતે ખૂબ સેવા કરનાર સાધુ-સાધી વૈયાવચ્ચી તથા શ્રમણ સેવા ટ્રસ્ટમાં કાર્ય કરતા એલર્ટ અજ્યાભાઈનું એલર્ટ ગુપ ઓફ ઇન્ડિયા તરફથી શાલ ઓછાઈ તથા રૂ.૨૫૦૦૦નું કવર આપી શ્રી કલ્યેશભાઈ, શ્રી જ્યોતિરભાઈ ભણશાલી આદિએ બહુમાન કર્યું હતું.

મંત્ર સંભળાવવાનું મુહૂર્ત-સમય આવતાં પૂજ્ય આચાર્યદીપ પાટ પર પધાર્યા હતા. વિધિપૂર્વક મુનિશ્રીને પંન્યાસપદનો મંત્ર સંભળાવી નૂતન પંન્યાસ તરીકે નામ સ્થાપન કર્યું હતું.

આ પ્રસંગે માતૃહદ્ય પૂ.સા.શ્રી કીર્તિપૂર્ણશ્રીજી, પૂ.સા.શ્રી મંદિરનિધિશ્રીજી, પૂ.સા.શ્રી મૃદુવર્ધનાશ્રીજી, પૂ.સા.શ્રી કૃતાર્થનિધિશ્રીજી, પૂ.સા.શ્રી કીર્તિપૂર્ણશ્રી (ડિસાવાળા)નો પરિવાર, પૂ.ભક્તિસૂરી મ.ના પૂ.સા.શ્રી વિનયરત્નાશ્રીજી મ. આદિ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂ.મુનિશ્રીના સ્વજનો સુરત-મુંબઈ વગેરે સ્થળોથી પધાર્યા હતા. અમદાવાદથી એલર્ટ ગુપના સરસેનાધિપતિ શ્રી કલ્યેશભાઈ, જ્યોતિરભાઈ આદિ, નાશિક ગુપમાંથી શ્રી રાજનભાઈ પરીખ તથા પ્રાણી-સુંદરી ગુપની આમંત્રિત બહેનો પણ ઉપસ્થિત રહી હતી. સેટેલાઈટ શ્રીસંધનું ટ્રસ્ટીમંડળ, શ્રી જૈનગર સંધના ટ્રસ્ટીભાઈઓ, વિસનગર શ્રીસંધના, હિમતનગર જૈન સંધના ટ્રસ્ટીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતો.

પૂ.મુનિશ્રી દાનપ્રેમવિજયજી મહારાજે એલર્ટ સર-સેનાધિપતિશ્રી જ્યોતિરભાઈ આદિને માર્ગદર્શન આપી પદવી પ્રસંગની તમામ વ્યવસ્થા સંભાળી હતી. શ્રીસંધના ટ્રસ્ટીમંડળો સુંદર સહયોગ આપ્યો હતો.

આવનાર ભાવિકોને ૨૫૦ રૂ.ની પ્રભાવના કરવામાં આવી હતી. આવનાર મહેમાનો માટે શ્રી સેટેલાઈટ સંધમાં તથા સુકૃત સેન્ટરમાં ભોજનની ત્રણે ટાઈમની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ શ્રી સેટેલાઈટ સંધે લીધો હતો.

### પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીની પ્રથમ પુણ્યતિથિ

સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી જગયોતિસૂરીશરજી મહારાજાને વિ.સ. ૨૦૭૭, કા.વ. ૧ની પ્રથમ પુણ્યતિથિએ એલર્ટ ગુપ તરફથી ઉત્કૃષ્ટ ભાવાંજલિ આપવામાં આવી હતી.

પૂજ્યપાદશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૈન એલર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પૂજ્યશ્રીની અભિનસંસ્કાર ભૂમિ અમદાવાદ - આંબલીના સમાધિ સ્થાને સમસ્ત રાજનગરના પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓનું અંદાજે ૮૪ લાખ (પૂજ્યશ્રીના ૮૪ વર્ષના ઉપલક્ષમાં)નું ઉત્કૃષ્ટ સન્માન-ભક્તિ કરવામાં આવી હતી.

એલર્ટ ગુપ ઓફ મુંબઈ તરફથી પૂજ્યપાદશ્રીના ૮૪ વર્ષ આયુષ્યના ઉપલક્ષમાં ગુજરાત-રાજ્યસ્થાન-મહારાષ્ટ્રની ૮૪ પાંજરાપોળોને પ્રત્યેકને ૧-૧ લાખ રૂ. દારા કુલ ૮૪ લાખ રૂ.નું અનુદાન એલર્ટ નિલેષભાઈ, એલર્ટ જિનેશ દોષી દારા જાહેર કરવામાં આવ્યું હતું.

આજના કા.વ. ૧ના દિવસે સમાધિસ્થાન આંબલી-અમદાવાદ સહિત સમુદ્દરાયના ૧૦૦ ઉપરાંત સાધુ ભગવંતોના ચાતુર્માસ સ્થળે તથા અનેક સાધીજી ભગવંતોના ચાતુર્માસ સ્થાનોમાં પૂજ્યોની પ્રેરણાથી એકથી લઈ પંચાલિકા મહોત્સવો, વિવિધ આરાધનાઓ, જાપ, અનુકૂપાદાન, જીવદ્યા, સાધ્યમિકભક્તિ, જિનાલયોમાં લાખેણી આંગી, વર્ક્ટ્યુસ્પર્ફાર્માઓ, નાટિકાઓ, ગુણાનુવાદ સભાઓ, સામુહિક આંબલી વગેરે અનેક પ્રકારના આયોજનો કરી દેશ-વિદેશમાં પૂજ્યશ્રીને મુઢી ઉચેરો પરિચય લોકોને કરાવવામાં આવ્યો હતો.

જોકે કોરોનાની વધતી અસરના કારણે અનેક સામુહિક કાર્યક્રમો-મિલનો વગેરે મુલત્વી રખાયા હતા. આ નિમિત્તે શ્રી સંધો-ટ્રસ્ટો તરફથી કરોડો રૂપિયાના દાન વિવિધ ક્ષેત્રમાં ફણવવામાં આવ્યા હતા.

સમુદ્દરાયના પ્રત્યેક સાધુ-સાધીના હૃદયમાં વસી ગયેલા પૂજ્યપાદશ્રીને પ્રત્યેક સાધુ-સાધીજી ભગવંતોએ અશ્વુભીની અંજલિ રૂપ વિવિધ તપશ્ચર્યાઓ કરી હતી.



તમે પ્રતિકમણ કરો એટલે તેમાં દર્શન-જ્ઞાન-ચરિત્રની આરાધના વગેરેના કાયોત્સર્ગ આવે છે. તે સિવાય દિવસમાં કે રાત્રિમાં આ રીતે કાયોત્સર્ગ ધ્યાને રહેવા અભ્યાસ પાળવો જોઈએ.

કાયોત્સર્ગ ધ્યાન કરવાથી તમારા સ્થાનની ઓરા શુભ બને છે. ત્યાં રહેનારે પણ શાંતિ અને પવિત્રતાનો અનુભવ થાય છે.

કાયોત્સર્ગ વારંવાર કરવાથી મનની એકાગ્રતા સધાય છે. તેના દ્વારા અનેક સિદ્ધિઓ અને ચમત્કારો જીવનમાં થાય છે. જીવન શાંત અને સમાધિમય બનનું જાય છે. ચિત્તની પ્રસંગતા વખતાથી પાપ બંધ ઓછો થવા લાગે છે. તેનાથી પૂર્વ બાધેલાં પાપ કર્મો ખરવા લાગે છે.

જૈન ધર્મના પ્રતિકમણ યોગમાં અભ્યંતર તપના અતિચાર રૂપે શ્રાવકોને દરરોજ કર્મક્ષય નિમિત્તે ૧૦ અથવા ૨૦ લોગસનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. એટલે દરેક જૈન દિવસમાં એકવાર આવો કાયોત્સર્ગ તો કરવો જ જોઈએ. જૈનાથી દિવસ દરમાના પાપ કર્મોનો નાશ થાય.

પાંડવ ચરિત્રમાં પણ વાત આવે છે કે જ્યારે દ્રૌપદીને જંગલમાં એકવાર આકાશમાંથી કમળ પડતું જોયું અને તેને લેવાની ઈચ્છા કરી. ભીમ કમળ શોધવા સરોવરમાં ગયો તો ત્યાં જ ગાયબ થઈ ગયો. પાછળ તેની તપાસ કરવા ગયેલા બાકીના ચારેય પાંડવોને સરોવરના સ્વામી શંખચૂડ દેવે સરોવરમાં ગુસ્સે થઈ નાગપાશથી બાંધી દીધા.

આ બાજુ પાંડવો પાછા ના આવતાં દ્રૌપદી તથા માતા કુંતિએ કાયોત્સર્ગ ધ્યાન કર્યું. તેના પ્રભાવથી ધરણેન્દ્રદેવે પાંચે પાંડવોને છોડાતી કુંતિને સોંચા. આવો પ્રભાવ કાયોત્સર્ગનો છે. મુશ્કેલીમાં આ રીતે કાયોત્સર્ગ ધ્યાન કરવાથી રસ્તો નીકળે છે.

કાયોત્સર્ગ કેવી રીતે શુદ્ધ થાય તેના માટે ૧૮ દોષોનું લીસ્ટ આપ્યું છે. તે દોષો ન લાગે તે રીતે કાયોત્સર્ગ ધ્યાન કરવાનું કર્યું છે. જેટલા દોષો લાગે તેટલો પાવર-પ્રભાવ ઓછો થાય છે. માટે તે દોષોને જાણી શુદ્ધ કાયોત્સર્ગ કરવા પ્રયત્ન કરવો જોઈએ. દુંકમાં જમીન ઉપર ઊભા ઊભા કયાંય ટેકો લીધા વિના સ્થિરતા પૂર્વક કાયોત્સર્ગ કરવો. ન થાય તો પલાંઠીવાળીને અથવા સૂતાં સૂતાં પણ થાય. પરંતુ મુખ્ય રીતે તો ઊભા ઊભા કાયોત્સર્ગ કરવાની વાત છે.

અંતે કાયોત્સર્ગ ધ્યાન અનાત્મભાવને કાઢી આત્મભાવમાં જીવને લાવીને મૂકે છે. જેમ છાસનું વલોણું કરતાં માખણ અલગ થાય છે. તેમ કાયોત્સર્ગથી આત્મા ઉપર બેટેલો મિથ્યા કર્માનો કચરો દૂર થતાં આત્મભાવ પ્રગટ થાય છે. એક અદ્ભુત અને સાચા આનંદની પ્રાપ્તિ થાય છે.

કુમશ:

અનુસંધાન પાના નં. ૫ ઉપરથી

સંન્યાસી છે ક્યાં ના પાડવી ! પણ તેને ઉપદેશ પસંદ ન હતો. એટલે સાધુને કર્યું એક શરત છે કે, ક્યારેય મને ઉપદેશ ન આપવો તો રહો. સાધુએ સ્વીકાર્ય. ચાતુર્માસ પૂરું થવા આવ્યું વિહારનો સમય થયો. વંકયુલને સાધુના યોગો જોઈ અંતરથી બહુમાન પ્રગટયું. વળાવવા ગયો. તેની પલ્લીનો એરીયા પૂરો થયો. એટલે સાધુએ તેને બેસાડ્યો. કર્યું ભાઈ હવે તારી પહ્લી નથી. તે અમને ઘણી સહાય કરી છે. હું તારા ઉપર શું ઉપકાર કરું ? જો તારી ઈચ્છા હોય તો તેને થોડાક નિયમ આપવા માંગું છું. એવા નિયમ કે તારા જીવનમાં કાયોત્સર્ગ તને નડશે નહિએ.

વંકયુલ આભારવશ થયેલો હતો. કર્યું, કહો શું નિયમછે. સાધુ મ. કર્યું, વંકયુલ તું સોઈને વાર કરવા (મારવા) જાય તો સાત ડગલા પાછળ જઈ પછી જ વાર કરવો. બીજો નિયમ અખાણ્યું ફળ ખાવું નહિ. ત્રીજુ, રાજીની રાણી સાથે ભોગ ન કરવો અને છેલ્લે કાગડાનું માંસ ન ખાવું !

વંકયુલે વિચાર્યું કે આ નિયમો મને કંઈ નડવાના નથી. લાવ મહાત્માની ઈચ્છા છે તો લઈ લઈ ! અને સાધુએ અભિગ્રહ પરચ્યકખાણ આપ્યું. નિયમો લાગુ પડ્યા. વંકયુલ વળાવીને પાછો પલ્લીમાં આવ્યો.

ત્યારપછી તો આ ચારેય નિયમો એક પછી એક ભાંગવા પડે તેવી પરિસ્થિતિઓ સહજી પણ દરેક વખતે તે પ્રતિશા પાલનમાં દફા રહ્યો. છેલ્લે એવી બિમારી આવી કે વૈધોએ તેને જો બચવું હોય તો કાગડાનું માંસ ખાવાની સલાહ આપી. પણ પથારીએ પડેલા વંકયુલે વિચાર્યુ. સાધુ પાસે પ્રતિશા કરી છે. કેવી રીતે તોડાય ! જીવનમાં પ્રતિશાના પ્રભાવે ત્રણ ત્રણ વાર બચી ગયો છું હવે શા માટે પ્રતિશા તોડું ? મનને સમજાયું. મનમાં દફાતાને ધારણ કરી. વૈધોને કહી દીધું, ‘જે થવાનું હોય તે થાય, મારાથી કાગડાનું માંસ ભક્ષણ નહિ થાય.’ અંતે પ્રતિશાના શુભભાવમાં મરી ૧ રમા દેવલોકમાં દેવગતિને પામ્યો. આ પ્રતિશા લીધી ત્યારે તેને પ્રતિશા લેવાનો ભાવ ન હતો. માત્ર દ્વયથી જ પ્રતિશાઓ હોવા છાતાં કેટલો લાભ થયો.

જીવનમાં ત્રતિ-નિયમોનું પાલન આત્માનો ઉત્કર્ષ કરે છે. આ લોકમાં તો લાભ થાય છે, જ્યારે પરલોક તમારો સેઈફ બને છે. નાના-નાના નિયમો પણ જીવનમાં શુભયોગોનું સરોવર છલકાવી દે છે. જૈન જેમપૂજા વિનાનો ન હોય તેમ નિયમ વિનાનો પણ ન હોય.

શાસ્ત્રમાં આવા નિયમોના વર્ણનો આવે છે. જેમાં ૧૨ પ્રતિનું ગ્રહણ મુખ્ય છે. તે પ્રતોના પાલન માટે બીજા અવાંતર અનેક નિયમો આપેલા છે. આવા નિયમો-ત્રતિનું પાલન સંસાર સમુજ્જ્ઞે સુક્રવારી ખાબોચીયું કરી દે છે અને જીવ એકવાર સત્ત્વ ભેગું કરી એક જંપ એવો લગાવે છે કે ખાબોચીયું ફૂટી જઈ સંસારથી અલવિદા કરે છે. મુક્તિસુભનો ભોક્તા બને છે.



## ઓલર્ટ ગુપ દ્વારા વિવિધ ઓક્ટેવીટી



આમોદ ગુપ દ્વારા ગરીબોમાં કૃતનું વિતરણ

ઔરંગાબાદ ગુપ દ્વારા નેત્રહીન પરિવારોને અનાજની કીટનું વિતરણ ભાયંદર (૧) ગુપ દ્વારા ગરીબોમાં મીઠાઈનું વિતરણ



ડબોઈ ગુપ દ્વારા ગરીબોમાં અનાજનું વિતરણ

કલ્યાણ ગુપ દ્વારા અનાજની કીટનું વિતરણ


નાશિક ગુપ દ્વારા ગરીબોમાં ચવાણાનું વિતરણ



રાજકોટ ગુપ દ્વારા ગરીબોમાં મીઠાઈનું વિતરણ

ઉમરગામ ગુપ દ્વારા અનાજની કીટનું વિતરણ

આમોદગુપ દ્વારા પોલીસ અધિકારીઓને પુસ્તકનું વિતરણ



માંડવી ગુપ દ્વારા પોલીસ અધિકારીઓને પુસ્તક તથા મીઠાઈનું વિતરણ

માનસમહિરાય તીર્થ સરકારની ગાઈડલાઇન મુજબ યાનિકો માટે ખૂલ્લુ થઈ રૂક્યું છે. દેવદીવાળીના રોજ શરૂંજથેલી ભાવયાત્રા કરતા યાનિકો

**સોજન્ય : સ્વ. કાન્તાબેન ચંદુલાલ મહેતા, ભાયખલા, મુંબઈ**

# શ્રી શત્રુંજય તીર્થધામ મુવનમાનુ માનસમંદિરમુ તીર્થ

Contact No. : 8551904888, 8551905888, 9823271991



માલિક : શ્રી અર્હદ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ

૧૭, પ્રાર્થનાપીઠ, ઈલોરાપાર્ક, જૈન દેરાસર પાસે,  
નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩

ફોન : ૦૭૯-૨૭૬૮૧૩૧૭

To,

તંત્રી-મુદ્રક-પ્રકાશક : કલ્પેશભાઈ વી. શાહ, અમદાવાદ

મુદ્રક : સર્વોદય ઓફસેટ, અમદાવાદ.